

THE ODYSSEY



2025-26

WWW.STANNSJAMNAGAR.ORG

What Awaits You

Reminisce and Retrospect

Message from Manager

Message from Principal

Editor's Desk

Editorial Board

Pedagogical Writings

IFP Panel

The Honour Roll

Full Attendance

Meet The Incumbents

Clicks from the clique

Read , Live & Inspire (English Corner)

From Pencil To Palette

The Highest Accolades

Gujarati Corner

Hindi Corner

Celebrations

Shiksha Fiesta – 2026

Colloquiums



Reminisce and Retrospect

History and Journey of ANNITE

Every successful story begins with a dream and desire.

The congregation of the sisters of St. Ann to which the sisters belong, is a Christian religious order founded by the pious couple of Turin (Italy) Carlo Tancredi De Barolo and Giulia Falletti De Barlo in 1834. Active in the field of education through the world since its origin, the congregation conducts in India nearly 50 High schools and over a dozen colleges in which thousands of young people, are being educated irrespective of caste and religion.

St. Ann's High School at Jamnagar is an English Medium School founded in 1953 and named after the great saint and patroness of our sisters.

St. Ann's Jamnagar from one building and a handful of students to a community thriving in the state of the art and infrastructure. The journey has been tremendous and still going strong.

Today when we look back and see, how it has grown to add another building, a well-equipped playground, smart class et al., our heart rises with pride to see that it has been worth every drop of sweat and blood utilized in the toil.

Over the years we have seen our students transform their dreams into reality and win laurels for themselves.

Seventy Two years of dedication and perseverance have brought us this far and our focus on the goal to have the welfare of society will take us further, to conquer new heights with the trust in God Almighty.



From the Manager's Desk



“ It gives me immense joy and pride to present the **School E-Magazine of St. Ann's School, Jamnagar**. This digital publication is a vibrant reflection of our school's **academic spirit, creativity**, and the diverse range of activities carried out throughout the year.

Education at St. Ann's goes far beyond textbooks. It is about **nurturing values, building confidence, and encouraging creativity**. This E-Magazine beautifully showcases the talents and achievements of our students across all sections—highlighting their dedication in academics, cultural activities, sports, and co-curricular pursuits.

I sincerely appreciate the tireless efforts of our **Principal, teachers, coordinators**, and the **editorial team**, whose dedication and teamwork have made this publication possible. Their guidance continues to inspire our students to strive for excellence and **personal growth**.

I extend my heartfelt gratitude to the **parents** for their constant support and cooperation, which strengthens our efforts to provide a balanced and nurturing learning environment for every child.

In an age of rapid change and **evolving challenges**, platforms like this E-Magazine empower students to think **creatively**, express themselves **confidently**, and grow holistically. I hope this publication continues to inspire our students to **dream big**, uphold strong values, and **pursue excellence**—not only in academic but in every walk of life.



I congratulate all the students who have contributed to this **E-Magazine** and encourage them to continue expressing their ideas, talents, and creativity with confidence. May this **magazine stand as a proud reflection of our vibrant school community** and a lasting source inspiration.

May God bless each and every one of you.

Sr. Jessy Peter
Manager





From the Principal's Desk

“The heart of education is the education of the heart.”

“Educating the mind without educating the heart is no education at all ”
said Aristotle.

Jacques Delors has rightly said that Education is based on four pillars of: Learning to Be, Learning to know each other, Learning to do & Learning to Live & share together". This school magazine stands as a testimony to that holistic vision of education.

Successful people constantly come up with new ideas, new projects and new & innovative ways of helping others. This means that your aims & objectives not just benefit you but also help benefit others as well. The contributions showcased here highlight the talents, reflections and achievements of our students, guided by the dedication of our teachers.

My sincere thanks to all our dedicated staff specially the editorial team and best wishes to all my wonderful students who make our lives more challenging & meaningful as we empower them to step out into the world and make their mark and contribute effectively to the society in which they live.

We aim to empower our children to become strong women of character and make them capable in the pursuit of worthy goals in the service of the nation and humanity. In the present era of digitalized world, the biggest challenge before us educators and parents to nurture the young minds with the indelible impressions of a holistic education. May this magazine motivate our students to continue exploring, questioning, and growing into responsible and compassionate individuals.

God bless our Annite family now and always.

Principal
Sr. Alice

Editorial

Dear Readers

*“All knowledge that the world has ever
Received comes from the minds; the
Infinite library of the universe is in your
own mind” – Swami Vivekananda*



This is a time of great changes, in education too we see fast changes. The student today as an individual is a real person with feelings of self-respect, sensitivity, responsibility and compassion. We need to recognize, appreciate, applaud and foster the fine blend of sensibilities in a child and thus this magazine is to be viewed as a launch pad for the children's creative urges to blossom naturally. As the saying goes, mind like parachute works when opened. This humble initiative is to set the budding minds free, allowing them to roam free in the realm of imagination and experience to create a world of beauty in words.

“ODYSSEY” unleashes a wide spectrum of creative skills ranging from writing to editing and even in designing the magazine. We showcase with pride the remarkable contributions made by our dear students and staff. All these, I believe would spur higher growth and enterprise in children.

I express my sincere gratitude to the Manager, Rev. Sr. Jessy Peter, the Principal Sr. Alice Joseph and our editorial board whose constant guidance and support was instrumental in bringing out this edition. My heartfelt thanks to all the teachers and students for this immense help in breathing life into these pages.

Mrs. Shikha Upadhyay

Editor – in – Chief

Editorial Board

“A journey of a thousand miles begins with a single step.”



Ms. Nandini Buddh



Mrs. Varsha Trivedi



Mrs. Wallari Joshi



Mrs. Rajshree Parmar



Ms. Salima Vanzar



Mrs. Remya R.

Student Editors

Kashvi Gandhi 9B

Milaunee Charadva 9C

Astha Vyas 11A

Sumaiya Kureshi 11B

Pedagogical

“Arise, awake and stop not till the goal is reached.”



આપણા સંબંધો

Reality of relationship.

હું રોજ એક ફૂલોના બગીચામાં જાઉં છું.
પંખી, પતંગિયા, પુષ્પોની સાથે,
થોડો સમય હું વિતાવું છું.

દરવાજો ખોલી એ કહે મને વેલકમ,
એના સ્વાગતમાં સરગમ હું ગાઉં છું,
ગુડ મોર્નિંગ કહે મને અહીંના ફૂલો,
ને હું એક સ્માઈલ મીઠું દઉં છું....

મારી શાળા શ્રી સેન્ટ આન્સ હાઇસ્કૂલ વિશે મેં લખેલી આ કવિતા કેવા સુંદર સંબંધો દર્શાવે છે.

જીવનમાં અનેક સંબંધોની માયાજાળ રચાય છે. જેમાંના કેટલાક સંબંધો અનાયાસે આજીવન ટકી રહે છે અને મધુર હોય છે. જ્યારે કેટલાક સંબંધો બહુ જાળવણી કરવા છતાં ટકી શકતાં નથી અને કડવી વાસ્તવિકતા બનીને રહી જાય છે.

સંબંધોની આવી વાસ્તવિકતા કંઈ આજકાલની નથી. એ તો રામાયણ અને મહાભારતથી પણ પ્રાચીન અને યુગોજીની છે.

જેની સાથે આપણે કામ કરતા હોઈએ તે વ્યક્તિ આપણને પોતાના મનની વાત ન કરે, પણ કોઈ બીજાની સાથે આપણાથી વધારે સંબંધો જાળવી રાખે... ‘ફોન કરશો કે તરત જ અમે આવી જશું’ , એમ કહેનારા આપણા સંબંધીઓ જરૂર પડ્યે ‘અનુકૂળતા નથી’ એવી પ્રત્યુત્તર આપી દે..., પેઢીઓ જુના સંબંધોમાં સંજોગવશાત્ એકાદ પ્રસંગે ન જઈ શકાય તો એ લોકો એવું કહેવા માંડે કે હવે આપણા સંબંધો નહીં રહે... ઘરે કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય ત્યારે નજીકના લોકો આપણી પડખે ઊભા રહેવાની માનવતા પણ ન બતાવે અને બીજાને ત્યાં શુભ પ્રસંગે યાત્ર્યા જાય

આપણે જેનું સપનામાં પણ બગાડ્યું ન હોય તેવી વ્યક્તિ પોતાને સર્વશ્રેષ્ઠ અને આપણને નિમ્નતમ કક્ષાના ગણાવી દે.

ત્યારે આપણે સહેજ પણ દુઃખી થયા વિના, આપણું સ્થાન શોભાવવાનું અને ઈશ્વરે આપેલું જીવન સાર્થક કરી બતાવવાનું. એ જ સંબંધોની અને આપણા જીવનની સાચી સફળતા છે.

મોરપીચ્છ

સાયું કાવ્ય એ નથી જે તમે લખી શકો છો.
સાયું કાવ્ય એ છે જે તમે જીવી જાણો છો.
વાસ્તવિક જીવનના ધુધવતા સંઘર્ષોની વચ્ચે,
તમે જે મધુરતા જાળવી શકો છો,
તમે જે રાસ રચાવી શકો છો,
તમે જે મોરપીચ્છ ધારણ કરી શકો છો,
તમે જે દ્વારિકા વસાવી જાણો છો,
એ જ તો છે તમારું વહાલું વૃંદાવન
ને પ્રિય ગોમતીઘાટ,
હા, કૃષ્ણ તમે પણ થઈ શકો છો.

વર્ષા આઇ. ત્રિવેદી
અધ્યાપિકા

Accounting is not merely a subject of numbers; it is an art that quietly governs everyday life.

From a homemaker managing household expenses to a business tycoon steering a global empire, everyone relies on accounting to understand income and expenditure, profit and loss.

It is the language through which financial reality speaks.

Thus, accounting is not confined to classrooms or offices; it becomes an inevitable and lifelong companion.

Career Options in Accounting

Accounting offers diverse and rewarding career paths, such as:

1. Chartered Accountant (CA) Cost and Management Accountant (CMA) – Focus on cost control, budgeting, and strategic planning.
2. Financial Analyst – Analyzes financial data to guide investment decisions.
3. Auditor – Examines financial records to ensure accuracy and compliance.
4. Tax Consultant – Advises individuals and businesses on tax planning and regulations.
5. Forensic Accountant – Investigates financial frauds and economic crimes.
6. Accounts Manager / Accountant – Manages day-to-day financial operations of organizations.
7. Banking and Finance Professional – Careers in banks, NBFCs, and financial institutions.
8. Academician or Accounting Educator – Teaching and research in accounting and finance.



જજમેન્ટ થી આગળ માનવતા

આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણે બહુ જ ઝડપથી કોઈને પણ જજ કરી લેતા થઈ ગયા છીએ. થોડાં સેકન્ડની વીડિયો ક્લિપ, અધૂરી માહિતી અથવા કોઈ એક પોસ્ટના આધારે આપણે કોઈ વ્યક્તિના સ્વભાવ, વિચારો કે જીવનના નિર્ણયોને માપી લઈએ છીએ. લોકોની પસંદગીઓ, પરિસ્થિતિઓ અને નાનકડી ભૂલોને લઈને તરત જ અભિપ્રાય બનાવી લેવો હવે સામાન્ય બની ગયું છે. પરંતુ આવી ઉતાવળભર્યું જજમેન્ટ ઘણી વાર સામેની વ્યક્તિ માટે માનસિક રીતે ખૂબ જ ભારે સાબિત થાય છે. શબ્દો તીરની જેમ વાગે છે અને વ્યક્તિને અંદરથી તોડી નાખે છે, જેનો અંજામ આપણે જોઈ શકતા નથી.

અત્યારે સૌથી વધુ જરૂરી છે થોડું થંભવાનું, સાંભળવાનું અને સમજવાનું. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે સંપૂર્ણ જાણકારી લીધા વગર તરત પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી. દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહી હોય છે અને દરેક પરિસ્થિતિની પાછળ એક કહાણી છુપાયેલી હોય છે. જો આપણે થોડો સમય લઈએ, સહાનુભૂતિથી વિચારીએ અને પછી સમજદારીપૂર્વક અભિપ્રાય આપીએ, તો સમાજ વધુ સંવેદનશીલ અને માનવીય બની શકે. જજમેન્ટ કરતા પહેલા સમજવાનો પ્રયત્ન કરવો- આજ સારી પરિપક્વતા છે.

અંતમાં એટલું જ કહી શકાય કે જો આપણે બધા મળીને થોડું ધીરજ રાખીશું, ઉતાવળભર્યા જજમેન્ટથી દૂર રહીશું અને એકબીજા પ્રત્યે દયાળુ તથા સન્માનસભર વર્તન કરીશું, તો આ દુનિયા ખરેખર રહેવા લાયક સુંદર જગ્યા બની શકશે. શબ્દો બોલતા પહેલાં વિચારીએ, નિર્ણય આપતા પહેલાં સમજીએ અને પ્રેમ ફેલાવવાનો પ્રયત્ન કરીએ. પ્રેમ આપવાથી જ પ્રેમ મળે છે. ચાલો, આપણે સૌ મળીને એવો સમાજ બનાવીએ, જ્યાં લોકો જજ થવાના ડરથી નહીં પરંતુ સ્વીકાર અને સમજણના વિશ્વાસથી જીવી શકે-અને આ દુનિયાને વધુ માનવીય, વધુ સુંદર બનાવીએ.

જાગૃતિ જોઈશર
અધ્યાપિકા

Ever experienced this?

Many times if something is happening right in front of your eyes,

You might feel like that particular event has been already Experienced by you but you can't remember.

This is a brain illusion termed as "Dèjà vu".

Many people of all ages experience this phenomenon.

It occurs when our brain processes that event twice at

The same time: first subconsciously and then consciously.

So whenever you experience this again, you know its Dèjà vu.

Mrs. Sonal Gandhi
Teacher (Science)

HOW ARE YOU

Generally the answer is “FINE”

Fine- in what sense - good health, feeling well, doing well in business or job,
Or the relationship with others.

The above meaning of fine leads to a conclusion of life with happiness.

So are you leading a satisfying life when you say I'm fine or are you still thinking about how to attain a satisfying life?

What kind of life do you wish to lead, what is satisfactory life?

Instead of searching for happiness in others why don't we find in ourselves?

Psychology has come up with a new branch named as POSITIVE PSYCHOLOGY introduced by Martin Seligman.

When we see an individual we first focus on the negative side but why don't we focus on the positive side.

The key strengths for positivity are: -

FORGIVENESS, GRATITUDE and HUMILITY.

- 1) Forgiveness - to let go of negative thoughts, feelings or behaviour towards an offender.
- 2) Gratitude: - feeling of appreciation or thankfulness in response to receiving a benefit.
- 3) Humility- accurate view of self not too high or too low.

By following the above measures psychologist have seen these changes in the life of people.

- 1) Rising to life challenges, making most of the setbacks and adversity.
- 2) Engaging themselves and relating to other people.
- 3) They were able to find fulfillers in creativity and productivity.
- 4) Looking beyond oneself & helping others also to find lasting meaning, satisfaction and wisdom.

Wishing all the readers a life filled with purpose, contentment and to spread kindness to live their best life.

"Kyunki hum ek hi baar jeete hai"

Mrs. Lincy B
Teacher (English)

"The Unseen Management"

"Moms: the ultimate multitasks, the invisible glue that holds it all together. Without them, life would be a total chaos.

Managing a household is often unrecognized, undervalued, and underappreciated, but it's the reason we get to live our best lives.

And let's not forget the working moms – you're crushing it on both fronts! Balancing office work and home life is like juggling multiple balls, but you're doing it like a pro!

So, let's not push them to the edge with endless demands... or else they might stage a protest. Imagine the chaos: laundry piling up, meals getting skipped, and Netflix reign supreme.

A mother's love is like oxygen – always there, often unnoticed, but essential for our survival.

So, let's give it up for the moms who keep our world spinning!

Mrs. Angelina Dabhi
Teacher (English)



Equations of Growth: India's 2025 Story

In mathematics, we often say that numbers never lie. As we close the chapter on 2025, the numbers quietly reveal how fast India is growing, and how those figures connect to our everyday lives.

Let's start with infrastructure, where the scale is impressive. India's national highway network crossed 1.46 lakh kilometres, reducing travel time and improving connectivity across cities and towns.

Indian Railways continued to modernise at speed, handling and estimation of 715 crore passengers annually while expanding electrification and upgrading stations.

These are real-life examples of distance, speed and efficiency; concepts we solve in classrooms, now visible outside them.

The energy sector made headlines too. In 2025, India added a record 44.5 GW of renewable energy, pushing total non-fossil fuel capacity beyond 260 GW. Solar energy played a major role, with panels lighting up rooftops, railway stations and solar parks across the country.

Sports inspired young India this year. Events like the Khelo India Youth Games and National Games saw participation from over 10,000 athletes, many competing at the school and college level. Each medal, record and scorecard reflected years of practice, discipline and data-driven training.

In entertainment, numbers spoke loudly as well. India's media and entertainment industry crossed ₹2.5 lakh crore in value, with streaming platforms reaching hundreds of millions of viewers. Films, web series and music found audiences far beyond borders, proving creativity also thrives on scale and reach.

As students, we often ask, "Where will we use maths in real life?" The answer is simple: Everywhere. From highways to solar panels, from scoreboards to screens; this year proves that when numbers add up, progress multiplies.

Mrs. Neema Shah
Teacher (Statistics)

“सेन्ट ऑन्स”

मेरी पाठशाला है बड़ी महान ,
जिसका नाम है सेन्ट ऑन्स ।

प्रवेशद्वार पर चौकीदार है विराजमान,
रखता है जो आनेवालों का ध्यान ।

महिला कर्मचारी हैं बहुत ही धैर्यवान,
करती हैं जो कार्यालय का सारा काम ।

शिक्षिकाएँ हैं यहाँ की बड़ी विद्वान,
जो देती हैं सारे विषयों का ज्ञान ।

कक्षाएँ भी हैं यहाँ की विशालमान ,
करती हैं जो छात्राओं का सम्मान ।

प्रधानाचार्या हैं हमारी बहुत दिलवान,
देती हैं जो हमें अनुशासन का ज्ञान ।

मेरी पाठशाला है बड़ी महान ,
जिसका नाम है सेन्ट ऑन्स ।

-सुष्मित कौर बजाज
अध्यापिका (हिंदी)



Stargazing **Success**

In the vastness of the night sky's
embrace,
A child looks up, finding their place.

Each star a dream, each planet a goal,
Guiding young hearts, inspiring the soul
Through the universe boundless expanse,

They learn that success is a wondrous
dance.

With knowledge and wonder, they boldly
strike,


In the cosmos of learning, they thrive.

So let us nurture each curious mind,
With wisdom and care, their paths
aligned.

For in watching the universe, we come to
see,

That success blooms from curiosity.

Mrs. Wallari Joshi
Teacher (Social Sci.)





MUSIC

Music is the art of organizing sounds and silence in time to produce a composition that can express emotions, ideas, or simply provide enjoyment.

It is a universal form of human expression found in every culture around the world, though it takes many different forms depending on the time, place, and people involved.

Core Elements of Music:

1. Melody – A sequence of notes that are perceived as a single, cohesive idea.
2. Rhythm – The pattern of beats or time in music.
3. Harmony – The combination of different musical notes played or sung at the same time.
4. Timbre (Tone Colour) – The unique quality or texture of a sound.
5. Dynamics – The volume of the sound.
6. Form – The structure or design of a piece of music.

In essence, music is sound with intention — whether for art, communication, ritual, or fun.

Mrs. Dhara Trivedi
Teacher (Music)

DIGITAL FOOTPRINT: WHAT YOU POST ONLINE STAYS FOREVER

Have you ever posted a photo, comment, or video online and then deleted it later? You may think it's gone forever.

But did you know that what you post online can stay there for a very long time — sometimes forever?

This is called your digital footprint.

What Is a Digital Footprint?

A digital footprint is the trail of information you leave behind every time you use the internet.

This includes:

- Photos you post
- Comments you make
- Games you play online
- Apps you use
- Websites you visit

Even when you delete something, there might still be a copy saved somewhere — like in someone else's screenshot or in internet records.

!Why Is It Important?

Your digital footprint tells a story about who you are online.

In the future, schools, colleges, or even employers may check your digital footprint to learn about you. That's why it's important to think before you post.

Ms. Nandini Buddh
Teacher (Computer Sci.)



Introduction of Virtual Panel (Interactive Flat Panel)

St. Ann's High School, Jamnagar took a significant step towards digital transformation by introducing the Virtual Panel (Interactive Flat Panel) during the academic year 2025–26. This modern educational tool was installed to update students with advanced learning methods and to make classroom teaching more engaging, interactive, and effective.

The Interactive Flat Panel combines audio-visual learning, touch-based interaction, and internet connectivity, enabling teachers to present lessons through videos, animations, presentations, and live demonstrations. Students actively participate by writing, drawing, and solving problems directly on the panel, which enhances understanding and retention of concepts. Complex topics in subjects like Science, Mathematics and Social Studies become simpler and more interesting through visual explanations.

The virtual panel also supports collaborative learning, encouraging discussion, creativity and critical thinking among students. It caters to different learning styles and keeps learners attentive and motivated. Teachers benefit by planning innovative lessons, accessing digital resources and saving time through smart tools.

The introduction of the Interactive Flat Panel reflects the school's commitment to quality education and technological advancement. It prepares students for a digital future while creating a dynamic and student-friendly learning environment. This initiative has been warmly welcomed by both teachers and students, marking a new era of smart education at St. Ann's High School.





The Honour Roll

Recognizing the Academic Triumphs

The Honour Roll

Std-12

Recognizing the Academic Triumphs

1st



**Kodinariya Kavya
Chetan**

2nd



**Chudasama
Sanskruti Ravindra**

3rd



**Solanki Dhyani
Hasmukh**

4th



**Gandhi Jamila
Burhanuddin**

4th



**Santani Pari
Paresh**

4th



**Vasa Palak
Nitesh**

5th



**Bhayani Vrushti
Hareh**

5th



**Hadiya Raiya
Jasvat**

The Honour Roll

Std-10

Recognizing the Academic Triumphs



PR - 99.89
(97.16 %)

**100%
Result**
2024-25



PR - 99.89
(97.16 %)



PR - 99.84
(96.83 %)



PR - 99.84
(96.83 %)



PR - 99.73
(96.33 %)

HSC 2024-25

Subject-wise Highest Marks, March 2025

Subject Code	Subject	Name	Marks	Subject Code	Subject	Name	Marks
006	English	Gandhi Jamila Burhanuddin	90	154	Elements of Accountancy	Chudasama Sanskruti Ravindra	99
008	Gujarati	Vaishnav Siddhi Keshavji	92	154		Solanki Dhyani Hasmukh	99
022	Economics	Gandhi Jamila Burhanuddin	97	154		Bhayani vrushti Haresh	99
046	Organization of Commerce	Vasa Palak Niteshbhai	98	331/332	Computer	Makwana Dhruvi Navinchandra	143
		Chudasama Sanskruti Ravindra	98	337	SPCC	Vasa Palak Niteshbhai	99
135	Statistics	Solanki Dhyani Hasmukh	100	139	Sociology (Art's)	Mehta Mansi Jignesh	87
		Santani Pari Paresh	100	141	Psychology(Art's)	Mehta Mansi Jignesh	84
135		Chudasama Sanskruti Ravindra	100	129	Sanskrit(Art's)	Makwana Dhruvi Navinchandra	95

SSC 2024-25

Subject-wise Highest Marks, March 2025

Sr. No.	Name	Subject	Marks	Sr. No.	Name	Subject	Marks
1	Faliya Prachi Amit	English	96	17	Bharmal Fatema Murtuza	Science & Tech	100
2	Faliya Prachi Amit	Social Sci.	100	18	Kas Mahenoor Mohammed Asif	Science & Tech	100
3	Raveshiya Nishita Harshal	Social Sci.	100	19	Modi Dhairya Nikhil	Standard Maths	100
4	Doshi Antara Jignesh	Social Sci.	100	20	Doshi Antara Jignesh	Standard Maths	100
5	Dattani Bhakti Sanjaybhai	Science & Tech	100	21	Kandoriya Hirva Govindbhai	Basic Maths	100
6	Faliya Prachi Amit	Science & Tech	100	22	Hathaliya Diya Karshan	Gujarati S.L	95
7	Kalyani Vrushangi Bhavin	Science & Tech	100	23	Ravani Sachi Piyush	Gujarati S.L	95
8	Kanani Yashvi Bhavik	Science & Tech	100	24	Mungra Riya Arvindbhai	Hindi S.L	98
9	Dhruve Riya Bhavin	Science & Tech	100	25	Dattani Bhakti Sanjaybhai	Sanskrit S.L	100
10	Raveshiya Nishita Harshal	Science & Tech	100	26	Hazuri Zainab Huzefa	Sanskrit S.L	100
11	Chudasama Krutisha Vimal	Science & Tech	100	27	Raveshiya Nishtha Harshal	Sanskrit S.L	100
12	Shukla Pushti Pragnesh	Science & Tech	100	28	Chudasama Krutisha Vimal	Sanskrit S.L	100
13	Mehta Shloka Mrudal	Science & Tech	100	29	Chandra Hardi Nitin	Sanskrit S.L	100
14	Bakri Arva Shokat	Science & Tech	100	30	Motiyani Maitri Anil	Sanskrit S.L	100
15	Doshi Antara Jignesh	Science & Tech	100	31	Hathaliya Diya Karshan	Sanskrit S.L	100
16	Jadeja Sakshiba Hitendrasinh	Science & Tech	100				

Full Attendance

2024-2025

Class	Name
1A	Domadiya Viya H.
	Savaliya Dheemahi B.
	Vyas Prisha H.
4C	Modi Diya A.
5B	Tanna Daisy R.
7B	Patodiya Vishwa A.
8C	Chandaria Jayani R.
9A	Nixy Sabu
10A	Madhani Zinal V.
	Solani Heer T.
10B	Kachwa Heer S.
	Kotecha Hiya J.
	Vasoya Shivani H.
	Zala Hetviba G.
10C	Jadeja Priyanshiba R.
	Jethva Kavya P.
11A	Parmar Bhavyata V.
12A	Bhayani Vrushti H.
	Chudasama Sanskruti R.
	Kalola Pia K.
	Motiyani Darshee P.
12B	Santani Neha P.
	Vasa Palak N.

2025 - 2026

Meet The Incumbents






Clicks from the clique

**TAKE A SNEAK PEEK
INTO OUR
AMAZING CO-CURRICULAR
CLUBS**

Creative Writing & Literary Club



Dance Club



Music Club




Science Club



Bag less Day



Activities



An abstract graphic featuring a white background. On the left side, there is a cluster of overlapping blue squares of various sizes, some of which are slightly offset, creating a sense of depth. A solid grey rectangle is positioned in the lower-middle part of the image, partially overlapping the blue squares and the text. The text "Read, Live & Inspire" is written in a bold, blue, sans-serif font, centered horizontally and partially overlaid by the grey rectangle.

**Read,
Live
&
Inspire**

'Words are like a prism which spreads the colours of their environment'

"Proper words in proper places make the true definition of a style"



“The English Corner”

"Pages of Pressure"

Tension fills the air,
Tick-tock, time's not fair.
Pages turn, pens scratch away,
Minds racing, doubts in play.

Memories fade, formulas blur,
Concepts mix, what's real, what's
blur?
The clock ticks on, heart beats fast,
Will I pass, or will I blast?
Caffeine fuels the anxious nights,
Notes and books, a desperate sight.

Each question looms, a daunting peak,
Will the answers make me weak?
But then a breath, a moment's
peace,
A glimpse of hope, a chance to ace.
The storm subsides, the mind clears
bright,
And in the exam, I find my light.

The pens glow on, the words flow
free,
Surprises wait, uncertainty.
The exam's done, the verdict's
sealed,
Whatever the result, I've reached.

In this test of life, I've done my
best,
With every try, I find my rest.
For in the exam, I find my strength,
And in the outcome, a new path's
length

HIYA MEHTA

9th A



Muse:

A guide for my journey of Art

The Dark, The Light
The Force, The Hope
The name, The feel
Yara, Tearsmith
In my poems still
The way it tortures me,
If tried tormenting others,
I am afraid, if they can survive
This poisoned Sea.
I declare it as the name
For Force, For Inspiration
With a touch of cruelty
Muse...

~Kaiyah...

Anta Hamirka
10thA

The Spring Season

When flowers blossom, when birds chirp, when branches of the trees sway,
I know that my favourite season spring has made its way.

Spring season is my favourite season.

It is a season of happiness and natural beauty.

For me, spring season brings beauty, joy, and positivity.

Robin Williams has said "spring is a nature's way of saying,
'let's party!'".

The best thing about spring is that nature comes to life.

The sweet fragrance of blooming flowers,
fill the air and give us refreshing feeling.

The branches of the tree sway as if they say "hi"

Every day and the birds sing their beautiful song.

Spring season also indicates new beginning, growth and hope.

Spring season gives a message that after every hardship,

There is a ray of hope for happiness.

The nature, especially flowers that bloom during the spring season inspire me.

I love the nature during spring season.

The nature inspires me to cherish the fleeting moments of the season.

Tvisha Shivang Mandalia

2ndB

How to Beat exam Stress?

I know when Exams are coming we may felt afraid and take stress like marks are low, parents will scold me etc.

But you may have hard work but you take stress than will be distracted than is better to focus on your study and don't be stressful. For focus and study well, you want to rest and sleep properly. Balance diet, that is minerals, proteins, vitamins and fats etc. this will keep you process and remind you to learn and read. Stress also affected on your health and it's not good for health. Than we have weakness, fill dizzy, high fever, vomiting etc. So, forget Stress and always be happy and important always be healthy person. This all will help you to Beat Exam stress!!

DON'T STRESS ! JUST RELAX.

Miloni Parmar

5th B



SAVE NATURE

Nowadays nature is polluted. Who is making nature polluted?

We, the people, are making nature polluted.

To save nature we should plant trees,

we should not throw garbage here and there.

But if we do like this, nature will not be clean,

and if nature is polluted, people will become sick.

Global warming will occur, and because of global warming,

landslides, cyclones, hurricanes, etc.

will be there, and people will get affected.

We should keep the rivers, lakes, ponds, etc. clean.

Hilly areas are more affected by heavy rainfall, cloud bursts.

Instead of petrol diesel, we should use PNG gas and LPG gas.

We should plant trees like peace lily, spider plant, bamboo palm, so they can purify air.

And also we should not litter garbage.

Instead of throwing garbage here and there

we should throw them in dustbin.

We should not use poly bags because they are not good for nature.

We should use common transports like bus, train, etc.

Many animals eat that garbage and plastics which is harmful for them. It is harmful for human beings and animals.

Divyanshi Sharma

7th B



Echoes of a Life Well Lived

*Life isn't measured by how far we run,
but by the quiet battles we've won.
By hearts we heal, by truths we keep,
by promises made, and dreams we reap.
It speaks not loud, but soft and low,
through every rise, through every blow.
For in our loss, in every scar,
we learn how strong we truly are.
The world may praise the ones who climb,
but peace belongs to those who find
a reason to smile, to breathe, to be
in life's small, unseen poetry.
So let the noise fade, the rush be still,
listen to what your soul would will.
For life is not in reaching the end,
it's in how we live, and how we mend.*

Vaishvi Dattani

11th B

"A New Day"

The sun is up, new day has arrived,
Birds are singing for every mankind.
Every man is having a fresh mind,
A fresh heart to work hard!
A new start, a brand new work of art,
To play a big part, with driven heart.
New hope to cope with challenges,
And mind that always balances.
Curiosity in each mind,
Answers you will surely find.
A story of each mankind
That God has already designed...!!

Sonakshi Meena

7th B



MY FIRST FRIEND

My first friend is my elder brother. I love him so much. He teases me so much. It's his style to show me love. I like to play with him. He takes care of me. He always protects me. He is my best friend, partner and supporter. He is my god gift. Our Jodi is perfect.

"HAVING A BROTHER IS LIKE HAVING A BUILT-IN BEST FRIEND FOR LIFE"

RAJVI BHANUSHALI 1ST B



Cricket



It is not a game,
It is an emotion.
Played by eleven,
Supported by 2.5 billion.
World cup is its Brain,
IPL is its heart.
WE are the fans,
And we don't stop the chants.
Cricket is a religion,
Sachin is the god.
Dhoni is the leader,
And Kholi is the king.
It is also played
By aliens.
As we have a superman,
Named Ab devillers.
It's a game,
Of sportsmanship.
Which is the best,
Proved by KIWIS.
We also have,
Great battle.
Like: Ashes,
And Ind vs Pak.



When India plays,
Whole nation supports.
Because we are not,
The one who supports.
It was born in Britain,
But bought up by India.
As we consider it,
As a religion.
It is not our,
National game.
But we consider it,
More than just a game.
From 1.3 billion,
11 are apart from crowd.
Who all together make,
The country proud.
1983 was a start,
To become the best.
And now we are,
On the top of the rest.
It is not just a game,
It is an emotion.
And by playing it,
We all get satisfaction.

Heer Purohit
7thB

Poem: - The City of Dreams

**Mumbai!... Mumbai!- the city of dreams,
It breaks you down through every streams.
From Bollywood glamour's to skylight view,
Here everything and everybody to you is new.
From the crowded trains,
To hefty, hefty, and hefty rains.
Here everybody comes to write their stories,
To which it replies that- if you are ready to face
anything,
Then at the end everything will be fine!!
Yes!.....Yes!- from the day struggles, chaotic life and
crowds all around;
If you survive all, it will make you stand tall and sound.
Here rents are high and hardship's more,
But it will make you strong from all that tore.
At the end of the day, fighting for your survival,
Thinking of all this sitting on the sea shore.
It reminds you that,
If you be strong enough then one day it's all worth it!!
That's Mumbai – the city of hustles, the city of dreams.
The city of chaos, the city that never sleeps.
The citycity of my Dreams!!**



Vrudhi Shah

12th A

MAKE IT GREEN

Lives are crying because it's not clean,
Earth is dying because it's not green
Earth is our dear Mother, don't pollute it,
She gives us food & shelter, just salute it
With Global Warming, it's in danger,
Let's save it by becoming a strong ranger
With dying trees & animals, it's in sorrow,
Make green today & green tomorrow
With melting snow, one day it will sink,
How we can save it, just think.
Trees are precious, preserve them,
Water is a treasure, reserve it
Grow more trees, make Mother Earth green,
Reduce pollution & make her a Queen

Gausiya Bhagat

4th C





My Life as an AI Student

My life as an AI student feels like a journey between Imagination and innovation. Each day, I dive into a digital world filled with codes, data, and endless ideas. Learning about Artificial Intelligence is like exploring the brain of the future – where machines learn to think, and creativity meets logic.

Sometimes, it's challenging to solve complex problems or understand strange algorithms, but I never give up. Every small success – like making a robot move or teaching a computer to recognize my voice – fills me with pride. Being an AI student has taught me patience, curiosity, and teamwork.

“The future belongs to those who code their imagination into reality.”

Khilji Samroz A.
8thC

FREYA AND CLOUD CAROUSEL

One sunny afternoon in the town of Breezy Ville, where clouds danced and giggled, lived a cheerful girl named Lila. She had a secret-an imaginary friend named Freya. Freya had shimmering wings, a giggle like wind chimes, and a magical umbrella that turned raindrops into jellybeans. Every day, when the sky turned golden, Freya would appear with a whoosh! Together, they'd ride the Cloud Carousel-a fluffy ride that spun through the sky, visiting places only imagination could reach. But one day, the clouds were too shy to come out. The carousel wouldn't spin. Lila felt sad. "What if the clouds are lonely?" she wondered. Freya smiled. "Let's cheer them up!" So they painted smiley faces on umbrellas, sang silly songs, and tossed jellybean raindrops into the air. Slowly, the clouds peeked out, giggling and glowing. The carousel spun again-faster than ever! From that day on, Lila and Freya became the official Cloud Cheer-Uppers. They reminded everyone that even imaginary friends can make real magic happen-especially when you believe in kindness, creativity, and a little bit of jellybean rain.

Riya Shah
8th A

Weird As I Am ?

Weird As I Am
They call me weird
But do they even know me?

Yea, I don't listen to music,
No movies, no insta, does that make
me strange?
Too noisy, too fake, why wouldn't I
refuse it?
Do you make the rules on what's
deranged?

My Starbucks order speaks my soul,
Venti Pink drink hiding in a black cup.
Sweet, cold, outta control.
Inside soft, outside tough.

They call me weird
But do they even know me?

You might wanna go to parties
But I'd rather stay home.
I'd rather write my own stories
Through light rain and
thunderstorms.

They call me weird
But do they even know me?
Black desk, pink neon sign,
Welcome to my room.

I love light rain and when the
lightning shines,
A video game controller with a
taped bloom.

Pages with dried raindrops and
smudged black ink,
Handwriting that's the opposite
of neat.

I scribble down what happened
today and my feelings.
Heart to pen, pen to paper
that's how I make it complete.

They call me weird
But do they even know me?

I'm as sweet as my cheesecake,
I'm as dark as my bike.
Bully me and make a mistake
I'm gonna cry—yea right, psych

They call me weird
But do they even know me?

They call me weird
But do they even know me?
One day you'll see me revered
For being me, steering my own
destiny.

Ayat Hingorj

7th A

Wake Up: We Are in the Era of Responsibility, Not Luxury

Wake up — because we are no longer living in the age of indulgence. The world doesn't need more consumers of comfort, it needs creators of change.

Wake up — and be so extraordinary today that even yesterday feels jealous.

Wake up — with a smile on your face, courage in your steps, and leave behind a trail of inspiration.

Morning is not just the start of another day — it is the start of greatness.

The best version of you is waiting — don't keep it asleep. Wake up and become it.

Remember, the alarm has already rung. The earth has already whispered its warnings. The only question left is:

Will we wake up in time?

Ajab Maskati

10th B

AN IMAGINARY FRIEND

Leo was a quiet boy. His parent's worked long hours, and he spent most of his afternoon in his room, lost in books and a world of his own making. Then, a friend appeared: a cheerful, mischievous creature named flicker, with fur the colour of twirling and eyes like polished stones. Flicker loved to play hide and seek, his laughter echoing only in Leo's ears. They'd spend hours building elaborate forts in the living room, their adventures epic.

One day, Leo's mother found him talking to a corner of the room. "Who are you talking to?" She asked, a gentle smile on her face. "Flicker!" Leo replied, pointing to the empty space "He just told a funny joke!"

As Leo grew older, Flicker started to fade. His laughter become a whisper, his presence a distant memory. One secret, but he wasn't there He'd moved on, as most imaginary friends do, leaving Leo with the quiet echo of their shared adventures.

The forts were gone, the laughter silent, but the warm of his first, secret friend remained in Leo's heart, a reminder of a special time when imaginary made the world feel a little less lonely.

Rutva Varotariya

7th B



A voice for equality

Feminism is the radical notion that women are people.

- Marie Shear

Feminism is not about making women stronger, they are already strong.

It is about changing the way the world perceives that strength.

At its heart feminism simply means 'EQUALITY'. Equal rights, equal respect and equal opportunities for all genders.

Feminism means the belief in and the movement for equal rights, opportunities, and freedoms for all genders. It challenges unfair treatment, discrimination, and stereotypes that limit people especially women in society. Feminism does not mean women are better than men; it means both should have the same chances, respect, and choices in life. At its core, feminism works to create a world where gender does not decide what a person can or cannot do.

- A Quick Look at History:

First wave (19th - early 20th century):

Fought for basic rights like the right to vote and own property.

Second wave (1960 -1980's):

Focused on equal pay, reproductive rights, and workplace fairness

Third wave (1990 -20's (present) :

Challenges stereotypes, embraces diversity, and supports the idea that equality benefits everyone.

Why it still matters today?

Feminism still matters today because gender inequality has not fully disappeared. Women around the world continue to face issues like unsafe environments, unequal pay, limited leadership opportunities, and strict social expectations. Feminism helps challenge these unfair systems and works to ensure that everyone regardless of gender has equal rights, equal respect, and equal opportunities. Until equality is real in everyday life, feminism remains necessary.

How students can support Equality:-

1. Learn & discuss - talk openly about gender issues in class or clubs.
2. Support each other - encourage everyone, friends, classmates, siblings to follow their dreams freely.
3. Treat everyone with respect regardless of gender, background, or appearance.
4. Speak up against bullying, discrimination, or unfair behaviour when you see it.
5. Include everyone in group activities and make sure no one is left out.
6. Avoid stereotypes and encourage classmates to choose any subject, sport, or hobby they like.
7. Educate yourself and others about equality, kindness, and fairness to create a positive school environment.

"Feminism reminds us that true equality is not a dream, but a responsibility we must carry together."

Arwa Golwala

9th B

The Glimpse

Let's have a look to where I sit,
A special place with a memory bit.
On which my creative thoughts hit
But, most exciting part is a window
seat

Just a step, and there's a light,
All natural and shining above the
height
A restaurant where people share
life

By having unforgettable night
A tree which was once a knight
Now is serving with a fight
Cars passing through a traffic light
Me asking them for a ride
“Quick ma'am has started to write”
Says my friend sitting beside
People can call this a distraction,
might
But for me it's an interactive sight.
The interaction of doing what is
right
May be a different but it's what I
like....!

Shriya Pala
12th A

A love with no end Mother

I thank you for all you gave,
For teaching us courage,
For making us brave.
You carried us through both
Dark and bright, and filled our
Hearts with endless light.

Please don't worry, we'll be okay,
You love still guides us every day.
I miss your touch,
Your gentle care, but feel
Your presence everywhere.

Thank you, Mum, for all
You've done, your strength
Now beats in everyone.
Forever my guide, my heart, my
friend.
Your love's a story
With no end!!

Sanjivani N
11th A

BEYOND THE BEAT:- THE GLOBAL RISE OF KPOP CULTURE

FLASHING LIGHTS CHEERING CROWDS, PERFECTLY TIMED DANCE MOVES FROM SEOUL TO SAN FRANCISCO AND EVEN TO THE BUSTLING STREETS OF MUMBAI AND DELHI THIS IS THE STORY OF HOW KPOP MUSIC TOOK OVER THE WORLD

HOW THE KPOP REVOLUTION BEGAN

Kpop short for Korean pop began its journey in the 1990s when south Korea's music industry started mixing local sounds with the global styles like hip hop and pop early groups such as "super junior" "girls generation" and "big bang" became National sensation and introduced Korean music to international level

The 2000s marked a turning point major entertainment companies like SM, YG, JYP and later HYBE began producing highly trained artists known for the flawless dance and powerful vocals

The reason behind kpop's popularity is its meaningful message, these artists talk about self-love, chasing dreams, and youth struggles their music gives hope and comfort to millions kpop idols connect deeply with fans through social media, music videos, answering heart felt messages, the fashion, choreography and visuals makes performance feels like a story

WHEN THE BEAT GOES GLOBAL

When the beat goes global, the world starts to move as one. From Seoul glowing stage to the streets of Mumbai, London and New York. K pop rhythms make people dance, smile and dream fans doesn't speak Korean sing every lyrics, copy every step and feel every emotion the colourful outfits, the sharp moves, the joyful energy it's all like festival that never ends

THE CRAZE OF KOREAN CULTURE AROUND THE GLOBE

Korean culture has taken the world by storm, by winning hearts with the perfect blend of tradition and modernity

K- Food is another part of this craze Korean cuisine is known for its spicy flavours and healthy ingredients

And that's Korean beauty that has changed the world skin care from glass skin routine to sheet mask and serum, Korean beauty products are admired from their innovation and natural glow

THE ROLE OF SOCIAL MEDIA

Social media platform like YouTube, Instagram have played a huge role in kpop's success many artists used the platforms to share their journey and connect with fans

From the shining stages of Seoul to the hearts of fans across the world Korean culture has become a bridge of emotion and dreams kpop beats ,heart felt k dramas and vibrant fashion have painted the world with colour and connection

THE WORLD NOW DANCES AS THE SAME RHYTHM ONE OF CULTURE AND MUSIC THAT TRULY GOES "BEYOND THE BEAT"

SUMAIYA KURESHI

11th B



Outdoor Games Are Magic

Outdoor games are magic for children. They make us happy, healthy, and strong. When we play outside, we breathe fresh air and feel the warm sunshine. Games like running, jumping, football, cricket, kho-kho, and cycling make our bodies active. Our muscles grow strong and our hearts become healthy.

Outdoor games also help our minds. When we play with friends, we learn to share, wait for our turn, and follow rules. We learn teamwork and kindness. Playing outside helps us feel relaxed and cheerful. It reduces stress and makes us smile more.

Outdoor games teach us important life skills. We learn to win with pride and lose with courage. We become brave and confident. Playing daily keeps our eyes bright, our minds sharp, and our bodies full of energy always happy.

Sarika Yadav
2ndB

Science facts:

Did you know? Your stomach gets a new lining every 3-4 days to protect itself from acid.

Did you know? Sharks existed before trees -over 400 million years ago.

Did you know? A caterpillar has more muscles than a human.

Food facts:

Did you know? Apples float because they're 25% air.

Did you know? Honey never spoils — 3,000-year-old honey was still edible!

Did you know? Carrots were originally purple, not orange.

Math's facts:

Did you know? The word hundred comes from hundredths, meaning 120, not 100!

Did you know? $111,111,111 \times 111,111,111 = 12345678987654321$

Did you know? A chessboard has 64 squares, but counting all sizes gives 204!

Twinkle Varia
8thA

Amazing Facts

Queuing is the only eight letter word that has five vowels in a row.

The atmospheric pressure above your head is 250 kg which is equivalent to 2 body elephants.

What is the number of hair on an average person? 5 millions.

Humans are only mammal that cannot breath and swallow at the same times.

Sloths may be clumsy on land but they are very good swimmer.

India is unique in having three of the six biogeographic zone. No other country on our continent has more than two.

Sloths bears are the only bears that carry their young on their back.

Jayshreeba Jadeja
9th A

The Earth saviour

Green green every time I see like a wave on a sea,
The more you plant more you get that never says no to be anywhere.
I am a purifier of your air and shelter f birds.
I never hurt anyone or cut anyone the way you people cut me.

Those roots are my lungs,
And birds are my friends.
I am not anyone else,
But a tree with endless facts!

Aarushiba Sarvaiya.
7th B



Jamnagar-" Choti Kashi" of Gujarat

Nestled in the western part of India, Jamnagar is often affectionately called "Choti Kashi" – a small yet spiritually rich city that mirrors the sanctity and cultural vibrancy of the famous Kashi (Varanasi). Renowned for its ancient temples, serene ghats, and deep-rooted traditions, Jamnagar is a unique blend of history, spirituality, and innovation. Beyond its spiritual charm, the city is also known for its royal heritage, vibrant markets, and eco-friendly initiatives that showcase its progressive vision.

* ARMY: -

- > Provides logistics and troop support due to strategic coastal location.
- > INS, Valsura, premier naval training institute for electrical and technology.
- > Jamnagar Air force station, one of India's largest bases; Headquarter of South Western Air Command.

• AYURVEDA UNIVERSITY:-

- >world's first Ayurveda University (1967) now institute of National Importance. Offers BAMS,MD/MS, PhD, Diplomas and courses for foreign students.

• ST. ANN'S HIGH SCHOOL:-

- >Founded in 1953 by sisters of St. Ann
- >English medium, up to higher secondary
- >Government recognised; focus on studies+ activities

• DARBARGADH:-

- >Royal residence with Rajput European style.
- >Heritage site, partly damaged in 2001 quake.

• BHUJIYO KOTH:-

- >Built in 1852 by Jam Ranmalji II
- >Damaged in 2001 quake, now under restoration.

• LAKHOTA LAKE:-

- >Built in 1740 by Maharaja Jam Ranmalji
- >Lakhota Fort in the middle


• VANTARA:-


- >3,000 acre Vantara Reserve in Jamnagar
- >Rescued tigers, leopards and wildlife

• BALA HANUMAN TEMPLE:-

- >Famous Hanuman temple with non-stop chanting
- >Known for longest continuous Hanuman Chalisa.

Manjari Sonecha
10th B





PARIKSHA EK TYOHAAR

EXAMS!! Just thinking about it makes us nervous. But you know what? Pariksha ek tyohaar has been a game changer for us!

HOW I FEEL DURING EXAM?

Anxious and stressed

Overwhelmed by syllabus

Fear of failure

Difficulty in concentrating

HOW IS PARIKSHA PE CHARCHA BENEFICIAL?

Reduces stress: - Our Prime Minister's words of wisdom makes us realize to feel stress free.

Boosts confidence: - It tells about the importance of believing in yourself.

Changes perspective: - It reminds us that exams are not only the measure of our worth, it's all about learning, growing and developing skills.

Provides tips and strategies: - It shares tips on time management, note making and revision strategies.

Pariksha ek tyohaar has been a lifesaver for us. It has helped many students to approach exams in a healthier way.

BHATT KAVYA

12thB

The power of imagination

An imaginary friend name marigold and his human friend, Jamie.

Jamie a quiet girl who often felt lonely, so he created marigold, a friendly and energetic dragon with shimmering green scales and a big smile. Together, they went on amazing adventures in the backyard. Which Jamie imagined was a dense jungle filled with ancient trees and colourful birds.

Marigold would guide her through "jungle". Helping her discover hidden paths and secret treasures. Like sparkling pebbles that were actually ancient jewels.

One day, a new family moved in next door. And a girl named angel come to play. At first, Jamie heisted. But marigold encouraged her, reminding her that were actually ancient jewels.

One day, a new family moved in next door. And a girl named angel come to play. At first, Jamie heisted. But marigold encouraged her, reminding her that friendship was even better when shared. Hesitantly, Jamie invited angel to join them in a jungle.

Angel was surprised by Jamie's "imaginary" world, but marigold, with his shimmering presence, seemed to make the game even more fun for both girls. As angel's laughter joined Jamie's, marigold found his own existence fading slightly, he was a figment of Jamie imagination, and the presence of a real friend meant his role was changing.

He continued to be there, though, offering quiet encouragement as Jamie learned to navigate the real world and share her unique spirit. Jamie real marigold wasn't just a way to play alone but a part of her own creative spirit, a friend who helped her find joy and confidence, even as her world grew bigger.

Moral of the story: The power of imagination to cope with emotions, build creativity and foster real world skills.

Sonecha Pavni
7thB





The Flower of Adversity

In tempest's rage,
Where petals bend,
A flower blooms,
It's beauty to amend.
Adversity's harsh test
it bears,
And in its scares, rare
beauty shares.

In darkest soil,
Seeds of strength
take root,
Nourished by pain,
Petals of courage,
Unfolding like a map,
Guiding through shadows,
To a brighter path.

This flower of adversity,
A masterpiece rare,
Forged in the test of life's uncertain gaze,
It's beauty lies not in perfection's shine,
But in the resilience, of its wounded,
beating heart's shine.

Anjali Siju
12th A



Poem –

The Light That Lives in Me

There's a spark that shines
in me,

Brighter than the deep blue
sea.

When I learn, when I try,

My dreams grow wings and
start to fly.

Every smile, every start,

Adds a rainbow to my heart.

Raina Khilji A.

1st A

Green Dreams in Plastic World

I dream of trees that danced in
rain, of rivers clean, and air again.
But when I wake, I sadly see,
Plastic floating in every sea.

The sky once smiled, so bright, so
blue
Now hides behind the dirty hue.
The bird still sing, but not so loud,
Their songs are lost beneath the
crowd.

We buy, we throw, and we never
care
The Earth just whispers "Please Be
Aware"
She gives us life, but what we give?
A world of waste where no one can
live.

If only hearts could plant a tree,
instead of trash beneath the sea.
Then maybe dream could turn to
gold,
And green would win the plastic
world

Tanna Daisy
6th B



Poem: My mental health

Take care of your health
Run out, walk out, and don't sit
inside,
Wash your hands, stay safe!
Keep positive thoughts and every day
play.

Cook your family dinner, bake
delicious cake.
Do some exercise don't be afraid.
Do some art, play some darts.

Some important things they have to
keep in their mind for example,
Prioritize physical health like: Get
regular exercise, eat healthy meals,
Stay hydrated, and get enough sleep.

Connect with others like:
Maintain social connections and talk
to people you trust.

Find relaxing activities like:
Engage in hobbies or activities that
help you de-stress.

Practice gratitude and focus on
positivity:
Try to see the good things in your life,
no matter how small.

Pay attention to the present:
Practicing mindfulness can help you
focus on the current moment.

Arohi R. Parmar
5th C

CHASE THE LIGHT

Dreams are stars that paints the sky,
Whispers of hope that never die.
But stars can't lead your steps alone,
You must keep walking on your own.

So hold you vision strong and clear,
And face each doubt without any fear.
For dreams are seeds – give them
their care,
They bloom with time, though slow
and rare.

To dream is magic, shining and true,
To made those dreams depend on
you.
To dream and work must share their
part,
To chase your dreams is strength of
heart.



Rajyaguru Pratiksha
11th B

“EPIPHANY”

~ Moments when clarity breaks through!!! ~

At times each one of us have different realizations regarding our own concerned thoughts but today there's something that held my heart strongly...- The epiphany of transformation over the years from being an innocent and child to a well understanding adolescent!!

It's not just that we changed by our appearance but also by our thoughts. From fumbling to use the cell phones to using social media platforms effortlessly! To always being amused by the shapes clouds formed to understanding the rainbow is actually science and not something out of wonderland! From struggling to learn A, B, C to mugging up the formulae.

From be happy after playing in the sand to being very conscious about our looks! In the rush and excitement of growing up we hardly realized that going back in time is what can fix us right now! The childish acts were way more beautiful than matured confusions!

The difference is that we involve in seeking validations and forget our actual selves. In the midst of ongoing confusion, we forget that we are someone totally different from others and following others blindfolded won't make us smart rather being authentic and understanding people would!

Let's period criticizing people, help them instead and look after shaping our own selves. Let us never allow our authentic and vibrant selves get lost and disguised in the rush of modern world.

Let's keep up the values taught in school rather than forbidding to follow them.
Why not end up the monotonous cycle of everyday and enjoy life
the way we always wanted it to be as a child!?

Why not hold up our maturity and never let go the hand of deep essence of childhood!? Let's just look back at our albums when we were the most artistic, creative, wonderful and most importantly authentic and yet never be afraid to steadfast our seatbelt for the life that's nevertheless a rollercoaster ride...!!!!

May this epiphany help us structure our lives with the most powerful realisation!!!!

Shakshi Meena
10thC

strongly believe that
the moment you decide
better at your chosen
men, you'll become me



Some Quizzes for Fun:

1. What starts with 'e' but only contains 1 letter?
An Envelope
2. What runs but never walks, has a mouth but never talks?
A River
3. What belongs to you, but others use more than you?
Your name
4. What goes up, but never comes down?
His/her Age
5. What comes one in minute, twice in a second moment and never comes in thousand years?
The letter 'M'
6. What is so fragile, that saying its name breaks it?
Silence
7. It has branches, but no leaves, trunks or fruit?
A bank
8. What kind of coat is always wet when you put it on?
A coat of paint
9. If you drop me, I'm sure to crack, but smile at me and I'll smile back? What am I?
A mirror
10. I have no life, but I can die. What am I?
A battery
11. If you have me, you won't share me. If you have shared me, you haven't got me?
A secret
12. I have eye but I can't see?
A needle

Amreen Nakhuda
6th A

Did you know the Facts!!

1. If you drive to the sun at 55mph, It would take you about 193 years.
2. Flamingos are not born pink. Their pink colour comes from the Crustaceans they eat.
3. A cloud can be as heavy as a Million pounds.
4. A cockroach can survive for Up to week without its head.
5. Australia is wider than the moon.
6. The internet is controlled by only 14 people and each holds seven keys.
7. The Eiffel Tower can "grow" in Summer due to metal expansion.
8. Astronauts grow taller in space.
9. Bananas are radioactive due to potassium.
10. Your stomach acid can dissolve razor Blades.

Khevna Zavari
7th C

Did you know?

1. An octopus has three hearts and two of them stops when it swims.

Two pump blood to the gills and one to the rest of the body when it swims, the heart that pumps to the body stops that is why they prefer crawling.

2. There are more trees on earth than stars in the Milky Way.

Earth has about 3 trillion trees. The Milky Way has about 100 – 400 billion stars.

3. Some snails can sleep for up to 3 years.

During extreme weather like drought, certain snails hibernate and seal themselves off.

4. Hot water freezes faster than cold water – sometimes.

This is called the Mpemba – Effect and it's still not fully understood by scientists.


Urja Kodinariya
7thB

Few Quips:

1. Why did the bicycle fall over?
Because it was two- tired.

2. What kind of tree fits in your hand?
A Palm Tree.

Jadeja Krishitaba
4thC



1. The Entire atmosphere weights about 57,000 more metric tons!
2. When you go out in the space you got 12 inches taller as on gravitational force is present.
3. Mercury whizzes around the Sun at 50 Km. per second.

Jenny Binoy 5thA




From Pencil To Palette


Through lines, shapes and colours, drawing adds magic to our school magazine.


Each art work is a Student's personal story, a moment captured or/a future imagined.


It's our charm to share vision, spark ideas and celebrate the artistic talent.




















FATEMA IMRAN KASMANI ★
IIIrd - A ★



Dhwaniba


Yukti

Yuhi A Konjariya I-A "A scenary" Roll No-22









THE HIGHEST ACCOLADES



Devyani Mahedu

**National karate
Championship 2025**



Viha Monani

**Dubai Cup 2024
Shotokan (Under17)**



Feni Lakkad

**SGFI State Level
Shotokan (Under 14)**

"शिक्षा हर दिन एक नई शुरुआत है।"



भाषा



भाषा

કાવ્ય –

“મારી શાળા- સેન્ટ આન્સ શાળા”

“કોઈ પૂછે મને, શાળા કેવી હોય?
મેં કહ્યું એને, સેન્ટ આન્સ જેવી.”

કોઈ પૂછે

મને.....

“ત્યાં તો જ્ઞાનની ગંગા વહે,
ત્યાં તો વ્હાલની વર્ષા વરસે.”

કોઈ પૂછે મને.....

ગમ્મત સાથે જ્યાં જ્ઞાન મળે,
વિદ્યા સાથે જ્યાં સંસ્કાર મળે,

કોઈ પૂછે મને.....

સફળતાની ચાવી, મારી સેન્ટ આન્સ શાળા,
સંસ્કૃતિની ઓળખ, મારી સેન્ટ આન્સ શાળા.

કોઈ પૂછે મને.....

જ્યાં જ્ઞાનના ભંડાર જેવા ગુરુઓ,
જ્યાં સુરજના તેજ જેવા આચાર્ય.


કોઈ પૂછે મને.....

“કોઈ પૂછે મને, શાળા કેવી હોય?
મેં કહ્યું એને, સેન્ટ આન્સ જેવી.”

કોઈ પૂછે મને.....

કક્ષા કાલાવાડિયા

૬ 'ક'



મિત્રની પરિભાષા

મિત્ર એક અનમોલ વ્યક્તિત્વ
મિત્રને માપવાનો ન હોય,
જાણવાનો હોય.

મિત્રની પરીક્ષા ન હોય,
મિત્ર જ એક પરિણામ છે.
મિત્ર સુખનો જ નહીં,
દુઃખનો પણ સાથી છે.

મિત્ર એટલે કોઈ કપટ નહીં,
પણ વહેતું ઝરણું છે.
મિત્ર અહેસાનનો નહીં,
પણ અહેસાસનો સાથી છે.

મિત્ર આંખની કીકી જ નહીં,
પણ હૃદયનો ધબકાર છે.

પરિધી શાહ
૬ 'ક'

સખી

સુખ અને દુઃખનો સંગાથ મારી સખી,
તડકાની મીઠી છાંય મારી સખી.

હોઉં હું ઉદાસ તો સ્મિત મારી સખી,
જિંદગીનું સુરીલું એક ગીત મારી સખી.

મીઠાં સંભારણાનું હાઈ મારી સખી,
શૈશવનાં સ્મરણોનો નાદ મારી સખી.

પળમાં રિસાતી ને પળમાં રિઝાતી,
મીઠાએ ઝઘડાની યાદ મારી સખી.

લોહીના સંબંધો નથી તોય કેવો નાતો,
એક જ આલિંગનથી બહુ મજબૂત થાતો.

કેટલાય થાકનો વિસામો મારી સખી,
મિત્રતાની સાચી મિસાલ મારી સખી.

પિંડુ કલ્કુ
૬ 'બ'



ઉત્તમ સોબત

સંતપ્તાયસિ સંસ્થિતસ્ય પયસો નામોયિ ન ભુવતે
મુક્તાકાર તયા તદેવ નલિનીપત્રસ્થિતઃ સ્વચ્ચો ॥
અન્તઃ સાગરશુક્તિમધ્યપતિતં તન્મૌક્તિકં સાધતે
પ્રાયેણાધમમધ્યમોત્તમગુણઃ સંસર્ગ તો જાયતે ॥

તપેલા લોખંડ પર પડેલા પાણીનું નામનિશાન
પણ જણાતું નથી. કમળનાં પાંદડાં પર રહેલું પાણી
જ પાણી મોતીના આકારે શોભે છે. સ્વામિ
નક્ષત્રમાં દરિયાની છીપમાં પડેલું તે - પાણી
મોતી બની જાય છે. ઘણુંબધું અધમ, મધ્યમ કે
ઉત્તમ સોબત-સંસર્ગ-થી થાય છે.

સારી સંગતિ માણસના જીવનને સુધારે છે
ખરાબ સંગતિથી મનુષ્ય ખોટા માર્ગે જઈ શકે
છે.

સંગતિનો પ્રભાવ માણસના વિચાર અને વર્તન
પર પડે છે.

સારા મિત્રો સાથેની સંગતિ જીવનને આનંદમય
બનાવે છે.

જેવી સંગતિ હોય તેવી વ્યક્તિ બનતી જાય છે.
બાળપણથી સારી સંગતિ અપનાવવી ખૂબ
જરૂરી છે.

સંગતિ માનવીના સ્વભાવને ઘડે છે.

સહવાસાત્ ગુણા જાયન્તે ॥
(સહવાસથી ગુણો ઉત્પન્ન થાય છે)

માનવી જેવો સહવાસ કરે છે, તેવો સ્વભાવ
અને ગુણ તેમાં વિકસે છે.

બાહ્યો વ્યાસ
૧૧ 'અ'

સફળતા માટેના સૂચનો

સફળતા દરેકનું સ્વપ્ન હોય છે. પરંતુ સફળતા માત્ર સ્વપ્ન જોવાથી પ્રાપ્ત થતી નથી, તે માટે આપણે સતત મહેનત કરવી પડે છે અને એ મહેનત યોગ્ય દિશામાં જાય તે જરૂરી છે.

૧. લક્ષ્ય નિશ્ચિત કરવું:

જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવું. લક્ષ્ય વિનાનું જીવન સુકાન વિનાની નાવ જેવું હોય છે. જીવનમાં લક્ષ્ય હંમેશા ઊંચું જ રાખવું જોઈએ.

“નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.”

૨. સમયનું મહત્વ:

સમય સૌથી મોટી મૂડી છે. તેનો હંમેશા સદુપયોગ કરતા શીખો. જો એક વાર સમય વીતી જશે તો ફરી પાછો નહીં આવે અને આપણે તેનો પસ્તાવો થશે. માટે જ અંગ્રેજીમાં કહેવાયું છે: “TIME AND TIDES WAIT FOR NONE.”

૩. અવિરત મહેનત:

સફળતા એટલી સહેલાઈથી મળતી નથી. તે માટે આપણે કઠોર પરિશ્રમ કરવો પડે. આપણે ધીરજ રાખવી પડે અને સતત મહેનત કરવી પડે. એટલે કહેવાયું છે: “પરિશ્રમ એ જ સફળતાની યાત્રી છે.”

“પરિશ્રમ એ જ પારસમણી”.

૪. આત્મવિશ્વાસ:

પોતાની શક્તિઓમાં વિશ્વાસ રાખવાથી મુશ્કેલીઓ સરળ બની જાય છે. માટે આપણે પોતાના પર અને પોતાની મહેનત પર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ. માટે જ અંગ્રેજી માં કહેવાય છે:

“SELF – CONFIDENCE IS THE FIRST SECRET OF SUCCESS.”

૫. નિષ્ફળતા:

નિષ્ફળતા મળે તો હતાશ અને નિરાશ થઈ જવાનું નહીં. તેમાંથી આપણે આપણી ભૂલો શોધવાની અને તેમાં સુધારો કરવાનો. કારણ કે જીવનમાં દરેક વ્યક્તિને એક વાર તો નિષ્ફળતા મળે જ છે.

માટે જ એક કવિએ લખ્યું છે:

“મને મળી નિષ્ફળતા અનેક, તેથી સફળ થયો કેંક જિંદગી માં”.

કુમારીકા સોનેયા

૧૦ અ

માતૃપ્રેમ

“વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે,
જનનીની જોડ, સખી! નહિ જડે રે લોલ.”

ઉપરની પંક્તિઓમાં કવિશ્રી બોટાદકરે માતૃપ્રેમની અપાર મહત્તા ગાઈ છે. જગતના સૌ સ્નેહસંબંધોમાં માતાનું સ્થાન સર્વોચ્ચ અને અનન્ય છે।

માતા પોતાના બાળકના સુખને ખાતર કેટલો બધો ભોગ આપે છે! તે દિવસ-રાત બાળકની સુખાકારીની ચિંતા કરતી રહે છે. બાળકની સંભાળ રાખવામાં તે જરાય ઊણપ રહેવા દેતી નથી. બાળકના ઉછેર, વિકાસ અને શિક્ષણની પાછળ તે પોતાની બધી શક્તિ ખર્ચી નાખે છે. બીમાર કે અપંગ બાળક પ્રત્યે માતાના હૈયામાં વિશેષ પ્રેમ છલકાય છે. માતૃવાત્સલ્યની મીઠી વીરડી સંજોગોના ગમે તેવા સખત તાપમાંય સુકાતી નથી.

ખરેખર, માતાના ત્યાગ અને વાત્સલ્યને કોઈ સીમા નથી હોતી. એટલે જ કહેવાયું છે કે —

“મા તે મા! બીજા બધા વગડાના વા!”
“ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.”

માતાઓએ જગતને અસંખ્ય મહાપુરુષોની ભેટ આપી છે. જગત પર શાસન કરનારાઓના હૃદય પર માતાના નિર્મળ વાત્સલ્યનું શાસન પ્રવર્તતું હોય છે. એટલે જ કહેવાયું છે —

“જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે.”

(The hand that rocks the cradle rules the world)

કવિશ્રી મલબારીએ ધરતીમાતાને જે ભવ્ય અંજલિ આપી છે તે દરેક માતાને પણ લાગુ પડે છે —

“અર્પી દઉં સો જન્મ એવડું, મા તુજ લહેણું!”

પશુપક્ષીઓમાં પણ માતૃપ્રેમનું તત્ત્વ જોવા મળે છે. ચકલી પોતાના બચ્ચાંને કેવી માવજતથી ઉછેરે છે! ગાય પોતાના વાછરડા પ્રત્યે કેવું વહાલ વરસાવે છે! પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે હરણી સિંહ સાથે બાથ ભીડતાં પણ અચકાતી નથી.

દેવોનેય દુર્લભ એવો નિઃસ્વાર્થ અને નિવ્યાજ માતૃપ્રેમ એ મનુષ્યને ઈશ્વરે પ્રદાન કરેલું અમૂલ્ય વરદાન છે.

ઉર્વશી ચંદાની

૧૧ બ

“રક્ષાબંધન પ્રસંગે ભાઈને પત્ર ”

ભંડકવાલા હાઉસ.
નૂર ફળી
ખોજા ચકલા
જામનગર.
તા.૬-૮-૨૫

આદરણીય ભાઈ અહેમદ,

તમારો પત્ર અને પૈસા મળ્યા. આશા કરું છું કે તમે મજામાં હશો. ગમગીન છું, કારણકે તમે અહીં મોજુદ નથી. તમને રડતા... રડતા... ગણાવી દઉં, કે તમે મારા માટે કેટલા મહત્વના છો. તમે મારા મિત્ર, મારા વિશ્વાસુ, અને વિકટ પરિસ્થિતિમાં મારા ભાગીદાર છો.

ઉનાળાના આળસુ દિવસોથી લઈને મોડી રાતની વાતચીત સુધી, આપણે સાથે વિતાવેલી યાદોનું હું સ્મરણ કરું છું. સાથે નિશાળે જતા ત્યારથી લઈને બંને અલગ અલગ દેશમાં કમાવા માટે ઉપડ્યા ત્યાં સુધી આપણે બનાવેલી નિશાનીઓ મારી આંખ સમક્ષ તરે છે. આ બધા પ્રસંગો મને ગમગીન બનાવી દે છે.

મને ખડક જેવી મજબૂત બનાવવા બદલ, સાથે મળીને જીવનનો ભાર હળવો કરવા બદલ, મને સ્નેહ કરવા બદલ, અને આખરે મને સાંભળવા હાજર રહેવા બદલ, તમારો ખુબ ખુબ આભાર.

હું તમને શબ્દોથી પણ વધારે પ્રેમ કરું છું. આપણે ખાલી રાખડીના દોરા વડે બંધાયા નથી, પણ હેતભરી યાદો, સ્મિતભર્યો પ્રેમ અને અતૂટ સાથ વડે જોડાયેલા છીએ. તમે આ પત્ર મળતા જ વાંચી અને જવાબ લખશો, એવી આશા રાખું છું. તમારું ધ્યાન રાખજો. પ્રણામ.

લિ.
તમારી વહાલી બહેન
આફિયા ના શુભાશિષ.



ટેકનોલોજી અને તેનો પ્રભાવ

આજના સમયમાં ટેકનોલોજી જીવનનો અગત્યનો ભાગ બની ગઈ છે. કામ હોય કે અભ્યાસ, માહિતી મેળવવી હોય કે સંપર્ક કરવો—બધું ટેકનોલોજીની મદદથી વધુ ઝડપી અને સરળ બન્યું છે. ટેકનોલોજીની પ્રગતિએ સમાજને નવી દિશામાં આગળ ધપાવ્યો છે.

ટેકનોલોજીએ દુનિયાને એટલી નજીક લાવી છે કે દૂર રહેતાં લોકો પણ રોજ મળતા હોય, તેવી અનુભૂતિ થાય છે. નવા વિચારો, નવી શોધો અને નવી રીતો જીવનને વધુ સુવિધાજનક બનાવે છે. ટેકનોલોજી દ્વારા મળતી તક માણસને પોતાનામાં રહેલી ક્ષમતાઓ ઓળખવામાં પણ મદદ કરે છે.

ટેકનોલોજીનો ઉપયોગ સમજદારીથી કરવો જરૂરી છે. વધુ ઉપયોગથી મન અને આરોગ્ય પર અસર થઈ શકે છે. સંતુલિત અને સાચા ઉપયોગથી ટેકનોલોજી જીવનને સુધારે છે અને વિકાસના નવા માર્ગો ખોલે છે.

“જ્ઞાન અને સાધન તો બધાને મળે, પરંતુ તેનો સંયમિત ઉપયોગ જ સાચો વિકાસ લાવે છે.”

જયતિ પોબારુ
૧૦ એ

માનસિક સ્વાસ્થ્ય આજના યુગનો પડકાર

આજના યુગમાં માનસિક સ્વાસ્થ્ય એક મોટી ચિંતાનો વિષય બની ગયું છે. આધુનિક જીવનની દોડ, રોજબરોજની જટિલતાઓ અને સોશિયલ મીડિયાનો અસીમિત પ્રભાવ લોકોના મનને બહુ ચિંતિત અને દુઃખી બનાવે છે. ઘણા લોકો પોતાની લાગણીઓ દબાવી દે છે અને સમય પર ધ્યાન ન આપવાથી માનસિક તણાવ વધે છે. જે શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.

માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે રોજિંદા જીવનમાં ધ્યાન, હળવો વ્યાયામ અને આરામ માટે સમય કાઢવો જરૂરી છે. પરિવાર અને મિત્રો સાથે ખુલ્લી વાતચીત કરવી, પોતાની લાગણીઓને સમજવી પણ મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે પોતાના મનની કાળજી લઈશું ત્યારે જીવન વધુ સુખી અને સંતુલિત બની શકે છે.

માનસિક સ્વાસ્થ્ય જીવનનો મુખ્યવાન ભાગ છે તેને અવગણવું નહીં સ્વસ્થ મન સાથે જ વ્યક્તિ સાચી રીતે સફળ અને ખુશ રહી શકે છે.

સુમૈયા કુરેશી
૧૧ બ

સંઘર્ષ

આપણને સફળતા સંઘર્ષ અથવા મહેનત કર્યા પછી જ મળે છે.

આપણા જીવનમાં સંઘર્ષનું ખુબ મહત્વ છે.

આપણા ઘણા બધા બહાદુરોએ યજ્ઞમાં છેલ્લે સુધી સંઘર્ષ કરીને જીત પ્રાપ્ત કરી હતી.

ઘણા ઉચ્ચ હોદ્દોધરાવતા વ્યક્તિઓ જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ, વાલબહાદુર શાસ્ત્રી, વગેરેના જીવનમાં સંઘર્ષ હોવા છતાં આગળ વધ્યા અને સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું છે.

આમ આપણે જોઈએ તો નાનામાં નાના પક્ષીઓ અને જીવોને પણ તેના ખોરાક માટે સંઘર્ષ કરવો પડે છે.

મનુષ્ય જેવા જીવને પણ તેના જીવનમાં આગળ વધવા માટે સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ આપણા જીવનનો એક ભાગ છે.

આપણને આપણા જીવનમાં સંઘર્ષ કર્યા વગર કંઈ મળતું નથી. આપણે આપણા જીવનમાં સંઘર્ષ કરીને અને બધી જ આવતી મુસીબતોને પાર કરીને સફળતા પ્રાપ્ત કરવી જોઈએ.

આપણે બધા જ ધીરુભાઈ અંબાણીનેજાણીએ છીએ તેઓના જીવનમાં ઘણા બધા સંઘર્ષો આવ્યા હતા પણ તેઓએ તે બધા જ ને પાર કરીને આગળ વધ્યા અને આજે રિલાયન્સ જેવી મોટી કંપની ખોલી. આમ આપણા ભારતમાં રતન ટાટા, નારાયણ મૂર્તિ, સચિન તેંદુલકર, ઇન્દિરા નોઈ, વગેરે જેવી વ્યક્તિઓના જીવનમાં પણ ખૂબ જ સંઘર્ષ હોય આમ છતાં તેઓ લડીને આગળ વધ્યા છે અને આજે તેઓ આખા જગતમાં પ્રખ્યાત છે.

આમ સંઘર્ષ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કહેવામાં આવે છે કે:

"મળે છે કષ્ટ લીધા વીણ, જગતમાં ઉન્નતિ કોને?
વિહંગો પાંખ વીંઝેછે, પ્રથમ નિજ ઉડ્યન માટે."

ધન્વી મોવલીયા
૧૧ બ

*જામનગરની પ્રાચીન રમતો – એક સફર ભૂતકાળથી ભવિષ્ય સુધી *

જામનગર... જ્યાં દરિયા જેવી ઊંડાઈ ધરાવતા લોકો છે, જ્યાં પરંપરા અને પ્રગતિ હાથમાં હાથ આપી ચાલે છે. અહીંની ગ્રામીણોમાં એક સમય એવો હતો કે જ્યાં બાળકોનાં હાસ્યથી આખું ગામ ગુંજી ઊઠતું હતું. આજે કદાચ મોબાઇલ, ટીવી અને ઇન્ટરનેટ વચ્ચે એ રમતો થોડી પાછળ રહી ગઈ હોય, પણ એ રમતો આપણાં દિવસોમાં હજી પણ જીવી રહી છે.

ચાલો, એ દુનિયામાં ફરીથી પ્રવેશ કરીએ....

* કબડી – શ્વાસ અટકાવીને જીતવાનો રોમાંચ

જ્યારે ટીમનો એક ખેલાડી 'કબડી... કબડી...' બોલતા બોલતા દોડે છે અને શ્વાસ અટકાવીને વિરોધીઓને પકડે છે, ત્યારે એ રમત માત્ર શારીરિક શક્તિની નહીં પણ મનની એકાગ્રતા અને ધીરજની પણ પરીક્ષા છે.

* કુસ્તી – પરંપરાનું બળ

મેળાઓ દરમિયાન ગામના યુવાનો એકઠા થઈ, કુસ્તીના અખાડામાં શીર્ષ બતાવતા અહીં કોઈને હારથી દુઃખ ન થતું, કેમ કે દરેક લડાઈથી શરીર મજબૂત બનતું અને દિવસોમાં આત્મવિશ્વાસ વધતો.

* ગિલ્લી-ડંડા – રમતમાં છુપાયેલું વિજ્ઞાન

એક નાનકડું લોકલ ગેમ 'ગિલ્લી ને ડંડા'થી હવામાં ઉછાળવું અને ચોક્કસ દિશામાં ફટકારવું – સાંભળવામાં સહેલું લાગે, પણ એ રમત એજલ, ગતિ અને ધ્યાનનું વિજ્ઞાન શીખવતી હતી.

* લંગડી – સંતુલનની મજા

એક પગે દોડાતી લંગડીમાં શરીરની મજબૂતી સાથે હાસ્ય પણ હોય છે...

* દોરી કૂદ અને મીઠી દોડ – તાલ અને ટીમ સ્પિરિટ

દોરીથી કૂદી કૂદી બાળકો શરીરની લવચીકતા વધારતા. મીઠી દોડમાં સ્પર્ધા કરતાં સહકાર વધારે જોવા મળતો.

* રાસ અને ગરબા – ઉત્સવમાં રમતનું રૂપાંતર

નવરાત્રિના નવ દિવસ દરમિયાન રાસ અને ગરબા માત્ર નૃત્ય ન રહેતા – એ સામૂહિક રમત બની જાય છે. પગલાં ગણવા, તાલ પકડવો, સાથે ગાવું એ બધું શરીર અને મન બંને માટે એક સુંદર અભ્યાસ છે.

* ઘોડાદોડ – ઉત્સાહથી ભરેલો ઉત્સવ

મેળાઓ દરમિયાન ગામના મેદાનો ઘોડાદોડથી ગુંજી ઊઠતા... એ રમતમાંથી સ્પર્ધાની સાથે મિત્રતાનું પણ સુંદર શિક્ષણ મળતું.

આજનો યુગ ટેકનોલોજીનો છે, પણ એ સાથે શરીર અને મન માટે જરૂરી રમતો ભૂલાતી જાય છે. ચાલો, આપણે જૂની રમતોને ફરીથી શાળાઓમાં, તહેવારોમાં અને પરિવાર સાથે જીવંત રાખીએ. ચાલો એક નવી શરૂઆત કરીએ!

वापस।..

माता-पिता हमेशा कहते हैं कि.....

“हम तुम्हारे भले के लिए कह रहे हैं”..

और वह सच बात है।

लेकिन मैं भी बस इतना कहना चाहती हूँ की...

कभी-कभी हमें अपना भला खुद तय करने दो।

हर बार जब आप हमारे निर्णयों पर शक करते हो...

तो वह हम पर नहीं ,

हमारे सपनों पर वार होता है।

माँ-बाप का प्यार कभी भी अपने..

बच्चों के लिए कम नहीं होता।

वह अपने बच्चों के लिए अच्छा ही सोचते हैं।

पर कभी-कभी वह प्यार प्रेशर बन जाता है।

बस एक बार बिना रोक-टोक के साथ चल कर तो देखिये।


भरोसा करके तो देखिये।

आपके बच्चें गिरेंगे नहीं उड़ेंगे।

और उड़कर ,सबसे पहले

आपके पास ही वापस लौटेंगे।

दृष्टि पबारी
10सी



काश

काश!

कोई ऐसा मशीन होता,
जो, देख पाता दिल के अरमानों को,

काश!

कोई ऐसा मशीन होता,
जो, देख पाता दिल में छुपी यादों को,

काश!

कोई ऐसा मशीन होता,
जो, देख पाता दिल में छुपे घावों को,

काश!

कोई ऐसा मशीन होता,
जो, देख पाता दिल में लगी मरम्मत की पट्टी को,

काश!

कोई ऐसा मशीन होता,
जो, दिल में छुपे राज को बयान कर पाता,

काश!

कोई ऐसा मशीन होता ।

नव्या मोटियानी
६ 'स'



विद्यार्थी जीवन

सुविचार:-

विद्यार्थी जीवन सर्वोत्तम काल है। यह समय सीखने, अनुभव करने और अपने भविष्य का निर्माण करने का है।

शिक्षा वह चाबी है, जो किसी भी बंद दरवाजे को खोल सकती है।

सफलता केवल मेहनत और साहस का परिणाम है, भाग्य का नहीं।

जो विद्यार्थी मेहनत से नहीं डरता, उसे कोई हरा नहीं सकता।

अनुशासन और समय का पालन विद्यार्थी जीवन को सफल बनाता है।

जो सीखता है, वही आगे बढ़ता है और दुनिया में बदलाव लाता है।

आज का सीखना ही कल की सफलता की नींव बनता है।

रिया शाह
'अ'

‘जीवन - मंत्र’

सेंट एन्स का प्यारा आँगन
ज्ञान, अनुशासन की ज्योति जगाए,
हर सुबह की प्रार्थना
मनमें नई उम्मीदें भर जाए।

शिष्टाचार की मीठी भाषा,
मुस्कान और विनम्रता हमारी पहचान;
“कृपया, धन्यवाद, क्षमा” –
ये शब्द बनें सच्चे संस्कार।
गुरु-जन और बड़े-बुजुर्गों का
सम्मान हमारा प्रथम आधार।

पुस्तकसंग जीवन-पाठ सीखें,
प्रश्नों से न डरें कभी;
सत्य-जिज्ञासा मार्ग दिखाए,
हर विषय हमें प्रिय सभी–
विज्ञान, गणित, इतिहास, भाषा–
ज्ञान की प्यास जगी सदा।

त्योहारों की महक से भरकर
जब ऋतुएँ मुस्कान लाएँ,
हम सब धर्मों के पर्व
हाथों में हाथ लिए मनाएँ।

दीवाली, ईद, क्रिसमस, होली,
रंग-सूरो में देश सजाएँ।

सेंट एन्स का उपवन सिखाता,
भारत विविधतामें खिल जाता।
सेवा का पावन मार्ग अपनाकर
प्रेम, करुणा के दीप जलाएँ;
विद्यालय का मोटो–
“Serve With Love” –
जीवनमंत्र बनाएँ।

वृष्टि निमेष पाला
9 C

छात्राणाम् कर्तव्यम्

छात्राः देशस्य भाविनः नागरिक भवन्ति। अतः
तं स्वकर्तव्यम् पालनं कुर्युः निश्चयेन छात्राणाम्
अनेकानि कर्तव्यानि समुचित चञ्चल ता। च
विहाय पाठ्यपुस्तकानि समुचित अभ्यासः
छात्राणां पथम् अस्ति। राष्ट्रभक्ति राष्ट्र रक्षा च
छात्राणां कर्तव्यम् अस्ति। मानवः जीवनस्य
आधारः भूमिः छात्र जीवनं एवं अस्ति। सत्यं
धर्मं, चर, स्वाध्यायः प्रवचनाभ्यां च मां
प्रमदितव्यम् श्रेष्ठानि कर्तव्यानि। चरित्र
निर्माणाय आवश्यक कर्तव्यं अस्ति। मातृ पितृ
, गुरुः आचार्यः संयम च इत्यादि गुणैः तस्य
चरित्र निर्माणं भवति। आदर्श छात्रः स्व
कर्तव्यम् सदैव पालयति। छात्रेषु एवं देशस्य
भविष्य निर्दरम् अस्ति।।

Maahi kasundra Class 8-C



Festivals

**National and Cultural
Festivals weave us
into the rich tapestry
of humanity**

JYOTISNA
PRAKASHAN

FESTIVALS

St. Ann's Feast



Navratri



Id-E-Milad





DAYS

Yoga Day



Independence Day



Major Dhyanchand Khel Mahotsav

(National Sports Day)



Gandhi Jayanti



Teacher's Day




Children's Day



Shiksha Fiesta-2026

Annual Exhibition





Colloquiums

